

June 2, 2021

To BSE Limited

Listing Dept./ Dept. of Corporate Services
Phiroze Jeejeebhoy Towers
Dalal Street
Mumbai - 400001

Security Code: 500101 Security ID: ARVIND

Dear Sirs,

To

National Stock Exchange of India Ltd.

Listing Dept., Exchange Plaza, 5th Floor

Plot No. C/1, G. Block

Bandra-Kurla Complex

Bandra (E) Mumbai - 400051

Symbol: ARVIND

Sub.: Submission under Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, we enclose herewith copy of the newspaper advertisement published in The Financial Express on 2nd June 2021 regarding transfer of equity shares of the Company to Investor Education and Protection Fund (IEPF) for your information and records.

Thanking you, Yours faithfully,

R. V. Bhimani

Company Secretary

Encl.: As above



FINANCIAL EXPRESS

भारतीय सचना प्रौद्योगिकी संस्थान भागलप INDIAN INSTITUTE OF INFORMATION
TECHNOLOGY BHAGALPUR
(An Institute of National importance under set of Parliament)

Advt. No.: IIITBH/Advt/2021/03/MTech Advt. No.: IIITBH/Advt/2021/04/PhD

M.Tech and Ph.D Admission 2021-22

Online applications are invited for M.Tech and Ph.D admission as Full-Time and Part-Time for autumn semester 2021-22. Please visit Institute websit www.iiitbh.ac.in for detailed information brochures and application forms. The last date for submission of online application is July 05, 2021.

Registrar (I/c)

E-Auction - Concast Steel & Power Limited (in Liquidation) Sale of Assets under the Insolvency and Bankruptcy Code, 2016

ted applicants may refer to the detailed EOI process document and other A Process Memorandum uploaded on website of the Corporate De reconcastispat.com/ncit.html and also on e-auction website indication aucidonider.net

The Auction Sale will be done through the E-Auction platform (with unlimited ex

Assets Lot	Manner of Sale	Inspection Date	Date and time of Auction	EMD Amount & Submission deadline	Floor Price
Asset Lot No.1- Bankura Unit	Standalone basis		21 June 2021 11:01 to 21 June 2021 18:00	INR 12.5 Cr on or before 18 June, 2021	INR 122 Crores
Asset Lot No.3- Srikakulam Unit	Standalone basis		21 June 2021 11:01 to 21 June 2021 18:00	INR 6.50 Cr on or before 18 June, 2021	INR 65.50 Crores
Asset Lot No.5 - Corporate Office Unit - 2*	Standalone basis		21 June 2021 11:01 to 21 June 2021 18:00	INR 25 Lakh on or before 18 June, 2021	INR 2.10 Crores

orporate Office location is 21. Centre Point, Hemant Basu Sarani, Kolkata – 7000 any query regarding, E-Auction, contact. Mr. Saptarsh Bardyar Mr. Navent Kurnar (986987/9962/ 79055/5965 Ernal 1. Comonat@ing, total (986987/9962/79055/5965 Ernal 1. Comonat@ing, total golf concast is pat. com/nctl. Himl. and also on E-Auction websis Sixicilauction accloringer.net.

psemanatorian sociamingenies.

Initiz Chhawchharia

guidator of Concast Steel & Power Limited (In Liquidation)

It Regn No-IBBIN-0.011IP-P00358/2017-16110616

gistered Address : Cilo. B. Chhawchharia & Co., 8A & B. Safyam Tower,

lighore Road, Kolksta - 700027. Email : Kshittig@bccondia.com

ARVIND LIMITED
CIN-LITI13G(13917)(C00093)
Website: www.anvind.com : Remail: investor@garvind.in Phone No. 079-68268
NOTICE
TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO
INVESTOR EDUCATION AND PROTECTION FUND [1879]

Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016 ('the Rules'), the final dividend declared during the financial year 2013-14, which remained unclaimed for a period of seven years will be credited to the Investor Education and Protection Fund (IEFF) within 30 days of September 3, 2021. The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as per the procedure set out in the Rules.

In compliance to the Rules, the Company has communicated individually to the con shareholders at their registered address whose shares are liable to be transferred to addiving them to claim the dividends and the details of such shares are also made av on the Company's website www.arvind.com.

Concerned shareholders holding shares in physical form and whose shares are liable to b transferred to IEPF may note that upon such transfer, the original share certificately which are registered in the name of original shareholders will stand automatical cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding shares i dematerialized form may note that upon such transfer, shares shall be debited from the

The shareholders may further note that the details made available by the Company on it website should be regarded and shall be deemed adequate notice in respect of issue duplicate share certificates) by the Company for the purpose of transfer of shares to IEP in case the Company does not receive any communication from the concerns shareholders before September 3, 2021, the Company with a view to adhering with the requirements of the Rules, transfer the corresponding shares on which dividend unclaimed for seven consecutive years shall also be transferred without any further consecutive years shall also be transferred without any further consecutive.

notice.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed dividend amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, if any, from the IEPF Authority after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, Shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents, Link Intime India Pt. Lid., 5" floor, 506 to 508, Amarnath Business Centre - 1 (ABC-1), beside Gala Business Centre, Nr. 5t. Xavier's College Corner, Off C. G. Road, Eliboridge Ahmedabad - 300006, Tel No. 1079. 26465179/86/87, e-mail: iepf.shares@linkintime.co.in

By order of the Board

Ishan Dyes & Chemicals Limited Reg. Off: Plot No. 18, GIDC Estate, Phase I, Varva, Ahmedabd 382445. Tel.: 079-25832144/2 E-mail: ishandyes@yshoo.com, Website: www.ishandyes.com

CIN: 22411063199394C020737

EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE FOURTH QUARTER AND THE FINANCIAL YEAR FINED 31ST MARCH 2021

Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended	Year Ended	
	31-03-2021	31-03-2020	31-03-2021	31-03-2020	
	(Audited)	(Audited)	(Audited)	(Audited)	
Total income from operations (net)	2813.72	2476.38	8398.70	8249.08	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	478.82	615.82	1722.36	1023.58	
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	478.82	615.82	1722.36	1023.58	
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	348.71	462.35	1280.79	820.84	
Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	348.71	462.35	1273.10	820.84	
Paid Equity share capital	1596.81	1596.81	1596.81	1596.81	
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-		4,810.30	3,696.87	
Earnings per share (before extraordinary items) (of Rs.10/- each) (not annualised): in Rs.					
(a) Basic	2.14	2.90	7.97	5.82	
(b) Diluted	2.14	2.90	7.97	5.82	
Earnings per share (after extraordinary items) (of Rs.10i- each) (not annualised): in Rs.					
(a) Basic	2.14	2.90	7.97	5.82	
(b) Diluted	2.14	2.90	7.97	5.82	

WESTERN RAII WA'

VARIOUS REPAIRS & PAINTING WORKS

Sr. Tender Notice No. No. & Date		Work and location	Approx. cost of work in ₹	
1	BCT / 21-22 / 64 dtd.31-05-2021			
includ	des all station bldgs	, station premises, service bldgs, etc but excl. staff qtrs., colonies, FOE		
2	BCT / 21-22 / 65	(Zone 6A-2) Santacruz-Virar sec: General repairs & Painting,	* 75 00 000 00	

jurisdiction or SSC (V) S-ambours with a Common section of SSE (V) Section of SSC (V) Sec

Name and set of variations in the jurisdiction of oscil, vip. One 4 Time of submission: Sr. No. 2 & 4: On 25-06-202
till 15.00 hrs and Sr. No. 1 & 3: On 29-06-2021 till 15.00 hrs. Date & Time of opening: Sr. No. 2 & 4: On 25-06-2021
till 15.00 hrs and Sr. No. 1 & 3: On 29-06-2021 till 15.00 hrs. Date & Time of opening: Sr. No. 2 & 4: On 25-06-2021 till 15.00 hrs. Regarding detailen fauture of work containing cost of tender document, EMO, eligibility criteria, similar nature of work, detailed tender conditions



Regd. Off. & Fact. Address : 41/3 & 41/5 Village Lohop, Lohop Chowk Rd.
Tal. Khalapur, Dist Raigad, Maharashtra, Pin Code: 410202
Email ID: tulaseebio@gmail.com

NOTICE We hereby inform you that Board Meeting of TULSEE BIO-ETHANO LIMITED will be held on Thursday, 10° June, 2021 at 11.00 A.M. at th 41/3, Village Lohop, Lohop Chowk Road, Tal. Khalapur, Dist. Raigad-Raigad-410202 to consider and approve the audited financial statement

along with auditor's report for the Financial Year Ended 31.03.2021 By order of the Board For TULASEE BIO-ETHANOL LIMITED Kapil Laitkumar Nagpai Direct DIN: 019293

NITÇO

Place : Raigad Date : 1" June, 2021

NOTICE

Notice is also available on the Compar site at http://www.nitco.in/Investo

3

SAL AUTOMOTIVE LIMITED

NOTICE

NOTICE

Pursuant to Regulation 47 of the SEBI
Listing Obligations and Disclosure
Requirements) Regulations, 2015 and
their applicable provisions, NoTICE
is hereby given that the Meeting of the
Soard of Directors of the Company will
ue held on 8" June, 2021 (Tuesday),
therails to Consider and some the

For SAL AUTOMOTIVE LTD

Date : 01" June, 2021

CLASSIFIEDS BUSINESS

SHARES & STAKES

WE BUYING: Listed / Unilsted All Company Demat/ Physical Shares. (IEPF/ Objection/ Pending/ Duplicate/ Transfer Services Provided.) "Investment House" 8291225710, 961921374.

0070741174-2

ITC Limited

	and Twelve Months ended 31st March, 2021 (6 in Crore									
			Standalone	•	Consolidated					
SI. No.	Particulars	3 Months ended 31.03.2021	Twelve Months ended 31.03.2021	Corresponding 3 Months ended 31.03.2020	3 Months ended 31.03.2021	Twelve Months ended 31.03.2021	Corresponding 3 Months ended 31.03.2020			
1	Total Income from Operations	14928.93	51775.53	12175.58	15983.86	55787.68	13228.40			
2	Net Profit / (Loss) for the period (before tax and Exceptional items)	4853.90	17164.15	4511.84	5039.22	17945.09	4743.47			
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	4853.90	17164.15	4511.84	5039.22	17945.09	4743.47			
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	3748.41	13031.64	3797.08	3819.62	13382.88	3926.72			
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	3775.44	13277.89	3035.87	3783.43	13589.79	3119.91			
6	Equity Share Capital	1230.88	1230.88	1229.22	1230.88	1230.88	1229.22			
7	Reserves (excluding Revaluation Reserve)		57773.70			59116.46				
8	Earnings Per Share (of ₹ 1/- each) (not annualised):									
	1. Basic (₹):	3.04	10.59	3.09	3.05	10.70	3.14			
	2. Diluted (₹):	3.04	10.59	3.09	3.05	10.70	3.13			

- he:
 The above is an extract of the detailed format of the Statements of Audited Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The Audited Financial Results and this extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at the meeting held on June 01, 2021. It is confirmed that the Statutory Auditors of the Company, M/s S R B C & CO LLP, Chartered Accountants, have issued Audit Reports with unmodified opinion on the said Standalone and Consolidated Financial Results. The full format of the Statements of Audited Standalone and Consolidated Financial Results are available on the Company's website (www.incorptal.com) and on the websites of the National Stock Exchange of India Limited (www.nseindia.com), BSE Limited (www.bseindia.com) and The Calcutta Stock Exchange Limited (www.cse-india.com).
- (www.nesindia.com), BSE Limited (www.bseindia.com) and The Calcutta Stock Exchange Limited (www.cseindia.com). The Board of Directors of the Company the Board of have recommended Final Dividend of ₹.5.75 per Corliancy Share of ₹1.4 each for the financial year ended 31st March, 2021. The Record Date fixed for the purpose of determining entitlement of the Members for the Final Dividend is Friday. 11th June, 2021 and such Dividend, if declared, will be paid on Friday, 13th August, 2021 to those Members entitled thereto. In addition to the above, the Board on 11th February, 2021 declared an Interim Dividend of ₹.5.00 per Addition to the above, the Board on 11th March, 2021 to the Members entitled thereto. Together with the Interim Dividend of ₹.5.00 per share paid on 10th March, 2021, the total Dividend for the financial layer ended 31st March, 2021 amounts to ₹.10.75 per share (total Dividend for the year ended 31st March, 2020.₹ 1.5.00 per share (total Dividend for the year ended 31st March, 2020.₹ 1.0.15 per share).

For and on behalf of the Board

Virginia House, 37 J.L. Nehru Road, Kolkata 700 071, India Chairman & Managing Director New Delhi, India Dated: June 01, 2021 Kolkata, India

Website: www.itcportal.com | E-mail: enduringvalue@itc.in Phone: +91-33-2288 9371 | Fax: +91-33-2288 0655 | CIN: L16005WB1910PLC001985















TICHOTES FABELLE SUNGEAN CLASSMACE TOPPINATE CONTENT CHARMIS AIM Toppinate FMCG | Hotels | Paperboards & Packaging | Agri Business | Information Technology

TIL Limited

Regd. Office: 1, Taratolla Road, Garden Reach, Kolkata 700 024, Tel: +91 33 6633 2000 / 2845, Fax: +91 33 2469 2143 / 3731

CIN: L74999WB1974PLC041725, Website: www.tillindia.in

Extract of Standalone (for the Three Months and Twelve Months Ended 31st March 2021)

				STANDALONE			CONSOLIDATED	
SI.	Particulars	TH	ree months end	led	Twelve mo	nths ended	Twelve mo	nths ended
No.	Fariculais	31st March 2021	31st December 2020	31st March 2020	31st March 2021	31st March 2020	31st March 2021	31st March 2020
		Unaudited (Refer Note 2)	Unaudited	Unaudited (Refer Note 2)	Audited	Audited	Audited	Audited
1.	Total Income from Operations	7,071	11,492	7,802	31,679	37,722	32,051	45,855
2.	Profit / (Loss) for the period (Before Tax, Exceptional and / or Extraordinary Items)	(4,594)	217	(4,798)	(7,222)	(4,312)	(7,365)	(3,363)
3.	Profit / (Loss) for the period Before Tax (after Exceptional and / or Extraordinary Items)	(4,594)	217	(4,798)	(6,998)	(4,312)	(7,141)	(3,363)
4.	Profit / (Loss) from Ordinary Activities After Tax (after Extraordinary Items)	(3,357)	231	(3,336)	(6,702)	(2,797)	(6,848)	(1,850)
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (After Tax) and Other Comprehensive Income (After Tax)]	(3,362)	229	(3,344)	(6,712)	(2,803)	(6,924)	(1,666)
6.	Equity Share Capital (Face Value ₹ 10/- each)	1,003	1,003	1,003	1,003	1,003	1,003	1,003
7.	Reserves (Other Equity)				20,390	27,102	21,987	28,911
8.	Earnings Per Share (Face value of ₹ 10/- each) #							
	(a) Basic (₹)	(33.47)	2.30	(33.26)	(66.82)	(27.89)	(68.27)	(18.44)
	(b) Diluted (₹)	(33.47)	2.30	(33.26)	(66.82)	(27.89)	(68.27)	(18.44)

Figures for three months ended are not annualized.

Place : Kolkata Date : 31st May, 2021

- 1) The above is an extract of the detailed format of Audited Financial Results for the year ended 31st March 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended. The full format of the three months ended and twelve months ended Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com/ www.nseindia.com/) and on the Company's
- 2) The figures for the 3 months ended 31st March 2021 and corresponding 3 months ended 31st March 2020 are the balancing figures between the audited figures in respect of the full financial year and the year to date figures up to the third quarter of the respective financial years
- The above Audited Financial Results, as reviewed by the Audit Committee of the Board, were approved and taken on record by the Board of Directors at its meeting held on 31st May 2021. Limited Review, as required under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015, has been carried out by the Statutory Auditors of the Company.
- 4) Exceptional item represents gain of Rs. 224 lakhs towards sale of a property, registered and owned by the Company, admeasuring 4636 square feet carpet area, situated at Unit No. 502-A. 5th Floor, Western Edge Tower No.1, Dutta Pada Road, Borivali (East), Mumbai 400066.

TIED Tractors India





For TIL Limited Sumit Mazumder Chairman & Managing Director









0143

ARVIND LIMITED

ARVIND LIMITED

IN - LI7119G19319ID(200093)

NARODA ROAD, AHMEDABAD - 380 025

Website: www.arvind.com : Email: investor@arvind.in Phon

NOTICE

TRANSFER OF EQUITY SHARES OF THE COMPANY TO INVESTOR EDUCATION AND PROTECTION FUND (IEPF

Notice is hereby given that pursuant to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016 ("the Rules"), the final dowlednd declared during the financial year 2013-14, which remained untalimed for a period of seven years will be credited to the investor Education and Protection Fund (IEFF) within 30 days of September 3, 2021. The corresponding shares on which dividend was unclaimed for seven consecutive years will also be transferred as por the procedure set out in the Rules.

In compliance to the Rules, the Company has communicated individually to the concerne shareholders at their registered address whose shares are liable to be transferred to IEPF address them to claim the dividends and the details of such shares are also made available on the Company's website www.arvind.com.

on the Company's website www.arvind.com. Concerned shareholders holding shares in physical form and whose shares are liable to be transferred to IEPF may note that upon such transfer, the original share certificate(s) which are registered in the name of original shareholders will stand automatically cancelled and be deemed non-negotiable. Concerned shareholders holding shares in dematerialized form may note that upon such transfer, shares shall be debited from their Demat account.

Demat account.

The shareholders may further note that the details made available by the Company on its website should be regarded and shall be deemed adequate notice in respect of issue of duplicate share certificate(s) by the Company for the purpose of transfer of shares to IEPF in case the Company does not receive any communication from the concerned shareholders before September 3, 2021, the Company with a view to adhering with the requirements of the Rules, transfer the corresponding shares on which dividend is unclaimed for seven consecutive years shall also be transferred without any further.

Please note that no claim shall lie against the Company in respect of unclaimed divident amount and shares transferred to IEPF. Shareholders may claim the dividend and corresponding shares transferred to IEPF including all benefits accruing on such shares, i any, from the IEPF Authority after following the procedure prescribed in the Rules.

For any queries on the above matter, Shareholders are requested to contact the Company's Registrar and Share Transfer Agents, Link Intime India Pvt. Ltd., 9th floor, 506 to 508, Amarnath Business Centre – I, dReC1.) b

(9,697.55) (6,424.82) 1 100 44

EXTRACT OF CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH 2021

109.05 (6,572.64)

ONHC એનએચસી ફુડ્સ લિમિટેડ

બોર્ડના ઢુકમથી અ ો ફુક્સ લિમિટેડ વર્લ્ડ અપ્ર

ફોર્મ નં. આઇએનસી-૨૬

અને ગાયત્રી પેસ્ટીકેમ મેન્યુફેક્ચરીંગ પ્રાઇવેટ લીમીટેડ (CIN:U45201GJ1978PTC00325લ)ન

ા અરજી કરવા દરખાસ્ત કરી છે. વ્યક્તિ જેખા તિતને કંપનીની રજીસ્ટર્ડ એફીક્સ દરાયોલ ફેરફારથી અતર થઇ શકે તેમ છે તેચ ડિરેક્ટરને સરવાયાં રીજનલ ડિરેક્ટર, ઉત્તર ત્રિજન, આરઓતી ભવત, રૂપાલ પાર્ક સોસાય કુંટ ખત્ત સ્ટોપ પાછળ, નર્સ્યાયુપ, અમધ્યલા દર્શાયતા એફીડેવીટની મહારથી તેતેણીના વાંપાય દર્શાયતા એફીડેવીટની મહારથી તેતેણીના વાંપાય

For Colgate-Palmolive (India) Limited K. Randhir Singh Company Secretary & Compliance Officer

wessies of Stock Extralegies and on No.US. Weelstel e. a. www.elcomg.rsci.com.

The Company is providing the facility of remote e-Voling as well as e-Voling during the AGM to all the Members to cast their vote electronically on all the resolutions set out in the Notice of the AGM. The Company has engaged the services of National Securities Depository, United r/NSDL/, for providing the e-Voling facility to the Members. Facility for e-Voling during the AGM will be made available to those Members who attend the AGM and have not already cast their vice. The Members who have cast their vice by remote e-Voling prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote again. The details of e-Voling and the process of e-Voling will be provided in the Notice of the AGM.

COLGATE-PALMOLIVE (INDIA) LIMITED

Information regarding the 80th Annual General Meeting of the Company to be held through VC/OAVM

NOTICE is hereby given that the 80° Annual General Meeting ("AGM") of the Company will be held on Thursday, July 29, 2021 at 3.30 pm. IST through Violeo Conferencing ("VC") or Other Audio Visual Means ("OAM") in compliance with the General Circular No. 10/2021 dated July 32, 2021 and General Circular No. 14/2020 dated April 8, 2020 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and Circular No. 15/2020 dated April 8, 2020 issued by the Ministry of Corporate Affairs (collectively referred to as "MCA Circulars") and Circular No. SEBIH/IOC/EDC/MDI/CIR/PI20/2011/11 dated Junuary 15, 2021 read with Circular No. 15/2011 for No. SEBIH/IOC/EDC/MDI/CIR/PI20/2011/11 dated Junuary 15, 2021 read with Circular No. 15/2018 by the Securities and Exchange Board of India, to transact the business that will be set forth in the Notice of the Meeting.

The Notice of the derives and Exchange Board of India, to transact the success are registered with the Company/Depository in accordance with the Annual Report for the Financial Year 2020-21 ("Annual Report") will be sent only by electronic mode to those Members whose email addresses are registered with the Company/Depository in accordance with the afforessial MCA and SEBI Circulars. The Notice of the AGM and Annual Report will also be available on the website of the Company and www. collegate/aninolive.co. in websites of Stock Exchanges and on NSDL's website i.e. at www.evoling.rsd.com

Regd. Off: Colgate Research Centre, Main Street, Hiranandani Gardens, CIN: L24200MH1937PLC002700
Tet +91 22 6709 5050; Fax: +91 22 2570 5088
Email Id: investors_grievance@colpal.com Website: www.colgate

not be entitled to câst their vole again. The details of e-Voting and the process of e-Voting will be provided in the Notice of the AGM.

Members whose email addresses are already registered with the Company/Depository, may follow the instructions for remote e-Voting as well as e-Voting during the AGM as provided in the Notice of the AGM.

Members whose email addresses are not registered with the Company/Depository may follow the below process for registering or updating their email addresses:

1. Members holding shares in electronic demat mode, please update your email address with your Depository Participants. However, Members may temporarily register the same with the Company's Register and Share Transfer Agent Le. Mis. Link Intitue Indial Private Limited at https://linkintime.co.in/emailreg/email_register.html on their website www.linkintime.co.in in the Investor Services tab by providing details such as Name, DP ID, Client ID, PAN, mobile number and email address.

2. Members holding shares in physical and who have not registered their email address may register the same with the Company's Register and Share Transfer Agent Le. Mis. Link Intime India Private Limited at https://linkintime.co.in/emailreglemail_register.html on their website www.linkintime.co.in in the Investor Services tab by providing observation and the same with the Company's Registrar and Share Transfer Agent Le. Mis. Link Intime India Private Limited at https://linkintime.co.in/emailreglemail_register.html on the revention the major and the same value of the same value and the same value an

Date: June 1, 2021

Xchanging Solutions Limited

Email: compliance@xchanging.com Website: http:

olidated financial results for the quarter and year ended 31/03/2021

Kalyani Tech Park - Survey No 1, 6 & 24 nm Hobli, Bangalore – 560 066, Karnataka, India 72200KA2002PLC030072

		(Rs. in lakhs exc						
Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/12/2020	Corresponding quarter ended 31/03/2020	Year ended 31/03/2021	Year ended 31/03/2020			
	(Refer note 1)	(Unaudited)	(Refer note 1)	(Audited)	(Audited)			
Total income from operations	5,014	4,666	4,886	21,167	19,494			
Net Profit for the period before tax	1,438	1,504	1,864	6,967	5,929			
Net Profit for the period after tax	1,389	1,501	1,793	6,244	5,470			
Total Comprehensive Income (After tax) for the period	1,342	1,590	2,329	5,959	6,288			
Paid up equity share capital (Face value per share Rs 10/-, fully paid)	11,140	11,140	11,140	11,140	11,140			
Other Equity (excluding Revaluation Reserve)	(1)	- 2		44,429	38,470			
Earnings per Equity Share (Face value of Rs.10/- each) (not annualised for the quarters)								
Basic- In Rs.	1.25	1.35	1.61	5.60	4.91			

Particulars	Quarter ended 31/03/2021	Quarter ended 31/12/2020	Corresponding quarter ended 31/03/2020	Year ended 31/03/2021	(Rs. in lakhs) Year ended 31/03/2020
	(Refer note 1)	(Unaudited)	(Refer note 1)	(Audited)	(Audited)
Total income from operations	1,310	1,154	1,288	5,548	5,838
Net Profit for the period before tax	269	453	513	2,220	2,633
Net Profit for the period after tax	305	502	339	1,821	2,269
Total Comprehensive Income (After tax) for the period	323	490	325	1,823	2,272
Notes:					

Chandrasekhara Rao Boddoju Managing Director and Chief Executive Office DIN: 08185777

लीय -१. টিपरोडत ३९ मार्च २०२९ ना पूरा थता ग्रिमाशिङ अने वार्षिङको जोडीट नालांडीय परिशामोनो विज्ञतवार होर्मेटको ઉतारो छे. पेजे सेजी (विरस् प्रोजिदिकेशनर अने डिसर्डामेसर टीडवारमेन्टरा) विकिम्योनो २०२५ ना विजियम ३३ हेळा रहीड ओडरओबन्मा रहू इन्देर छे. आ ग्रिमाशिङ जने वार्षिङ नालांड परिशामोनो संपूर्व विज्ञतो रहोड ओडरचेन्यनो वेजशार्डर www.bseindia.com अने www.nseindia.com छिपर छिपराध छे तथा रूपनी वेजशा

કમ તં.	વિગતો	ત્રણ માસના અંતે	પૂર્વવતી ત્રણ માસ અંતે	અગાઉના વર્ષે સમાપ્ત થયેલ અનુરૂપ ત્રણ માસ	નાણાંકીય વર્ષના અંતે	પૂર્વવતી નાણાંકીય વર્ષના અંત
		૩૧/૦૩/૨૦૨૧ (ઓડિટેડ)	૩૧/૧૨/૨૦૨૦ (અનઓડિટેડ)	39/03/૨૦૨૦ (ઓડિટેડ)	3૧/૦૩/૨૦૨૧ (ઓડિટેડ)	૩૧/૦૩/૨૦૨૦ (ઓડિટેડ)
q	કામકાજમાંથી ચોખ્ખુ વેચાણ/આવક	388.64	39.86	3₹∠4	88.558	P8. PEP
5	રામાન્ય પ્રવૃત્તિઓથી કર પહેલાનો નફો/(નુકશાન)	(PP.9E5)	(૬૫૩.૨૨)	(9039.99)	(૪૫૯૫.૬૧)	(65.8996)
3	કર પછી નો નફો/(નુકશાન)	(ફક્ય.૯૬)	(P& 585P)	(5303%0)	(80.5938)	(5396.36)

પોતાની વેબસાઈટ એટલે કે www.cera-india.com પર અપલોડ કરેલ છે. અત્યાર સુધી ક્લેઇમ નહીં કરેલ ડિવિડન્ડ અને આઈઈપીએક ઓશોરિટીને ટ્રાન્સફર ઘવાને પાત્ર શેરની વિગતો યકાસવા માટે શેરધારકોને આ વેબસાઈટ ચેક

કરવા વિનંતી છે. આ અંગે કૃપા કરી નોંધ લેશો કે જો તમારી પાસે ફિઝીકલ સ્વરૂપે શેર્સ હોય તો તેનું ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ જારી કરવામાં આવશે અને આઇઈપીએફને ટ્રાન્સફર કરવામાં આવશે. તમારા નામે નોંધાચેલા હોય અને તમારી પાસે હોય તેવા ઉડપ્રીકલ શેર સર્ટીફીકેટ આપોઆપ રદબાતલ થઈ ગયેલા ગણવામાં આવશે અને જો તમારી પાસે શેસ ઇલેફ્ટ્રોનિક સ્વરૂપે હોય તો આઇઈપીએફને ટ્રાન્સફર થવાને પાત્ર શેરો માટે તમાકું ડિમેટ એફાઉન્ટ ડેબીટ કરવામાં આવશે.

સેરા સેનિટરીવેર લિમિટેડ રાજસ્ટડ આફિસ: ૯, જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, કડી-૩૮૨૭૧ જિ. મહેલાણા, ગુજરાત. ટેલિ: (૦૨૭૬૪) ૨૪૨૩૨૯, ૨૪૩૦૦૦ ઈ-મેઇલ: kad@cera-inda.com વેબસાઇટ: પ્રપ્યા

नोटिस

આ નોટિસ ઇન્વેસ્ટર એષ્ક્યુકેશન એન્ડ પ્રોર્ટેશન કંડ ઓચોરિટી (એકાઉન્ટીગ, ઓડિટ, ટ્રાન્સફર અને રિકંડ) નિયમ 2016 અને વખતો-વખત પર તેમાં શતા સુધારા ('નિયમો') ની સાથે વાંયતા કંપનીઝ ધારા, 2013 ની કલમ 124 (6) ની જોગવાઈઓ અનુસાર પ્રકાશિત કરવામાં આવે છે.

ના જાનાવાળા બાબુના ર પ્રકાશત રવામાં આપ છે. આ નિયામે મુખ્ય તમા રેશ પાસે જેમાં મેતા તમે છેલાં સાત આટલા લધુ વર્ષોથી ડીલીંડન્ડ કરીઇમ ન કર્યું હોય તેવા તેરાયારોના સેરી કેના સરકાર કારા સ્થાપવામાં આવેલી ઇન્સેસ્ટર વેમ્પુક્રેકાન એક. પોટેકાન કંટ (સાઇપીપીક) એક્સોટિટી (બાઇપીપીક) એક્પિકન મેં સ્થાસ્ત કરવા અંગોની નેપાવાઈ કરવામાં આવેલાં છે. ઉપરાંત, પારેક્ટન જોગલાઈએ અનુમાર, કંપનીલે પાયેકત નિયામે હેલન જેમના સેરી આઈપીપીક એગોટિટીમાં દ્રાનાફ રચાને પાય હોય તેવા શેરાયારોમે લોંગ્ય પારાલાં લેવા માટે તેમના કંપની સાથે નોપાવાઈ સ્ટાનમાં ઉપર વ્યક્તિગત દીતે નોટિસ પણ મેકલેલ છે. કંપનીલે આવા દેશપાટો અને આઈપીપીક એગોટિટીને દ્રાનાફર વર્ષોને પાયે સેરીની દિવસે

ત્યનું પહાર તો બાઇઇ ખાલકું કે તું કરાવું કે લાગ માં તે કરતા તતા હત્તમનું ઇમ્મદ બલાઇલ ક્યાર કરવામાં બાયમ અથ્લી આવા તમામ કે પ્રેશ્વાસને નોરિક અને સાને કે સિન્દિરિક રામે અને કામે માના, બી-વિંગ પિવિલોન, આંબલી બીઆરટીએસ રોક, ઉરકોન ચાર રસ્તા, અમદાવા – 380053, કોન જી-94911222 અથા ઈમેઇલ: homans.adwinder@ora-india.com પર લીતિનમાં લાવો કરે, જેથી બા કેરી આઇઇપીએક એશીરીમાં ટ્રાસ્ટેક કરવામાં ન આવે. કુખ કરીને નોંધ હેશો કે સંબંધિત શૈયાર કો પહેલી જો રેપમી સપ્ટેમ્બર ૨૦૨૧ ના દિવસ મુખીમાં જો કોમ બીના કેની પાત્રે અલે તેની ત્યા કૃષ્ટ કોમીના, પહેરીને જેવાઇએનું પાલન કરી, પાકની તારીમે કંપની તેમના કેરી આઇઈપીએક ખાતામાં ટ્રાન્સકર કરવાની કરજનું પાલન કરશે.

કૂપા કરીને નીંધ લેશો કે ઉપરોક્ત નિયમો અનુસાર આઇઈપીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલ શેર અને ક્લોઇમ નહીં કરવામાં આવેલ વિકિટ્ડનના સંદર્શમાં કંપની વિટ્રક કોઈ દાવો રહેને નહીં. એ બાબતની નોંધ લેવામાં આવે કંપાઈપીએફમાં ક્લાફક કરવામાં આવેલી. એ એકિડિક્ડને કોમોમાં સુયવવામાં આવેલ પ્રક્રિયનું ખાલન કોમ પછી આઈઈપીએફ પાસેશી પરત લેવા માટેની વીધી કરી પાછ મેળવી શક્ય છે. વધુ વિરુત્તો આઈઈપીએકની

વેબસાઇટ www.iepf.gov.in. પર ઉપલબ્ધ છે. સેરા સેનિટરીવેર લિમિટેડ વતી

તારીખ: 1 લી જુન, 2021 સ્થળ: કડી

R. V. Bhimani

INDIA RADIATORS LIMITED

CIN: L27209TN1949PLC000963

Regd. Off: 88, Mount Road, Guindy, Chennai 600 032. Tel: 044-40432210

Fmail: cs@indiaradiators.com Website: www.indiaradiators.com

(Rs.in lakhe							
			Quarter Ended			Year Ended	
SI.no	Particulars	31.03.2021	31.12.2020	31.03.2020	31.03.2021	31.03.2020	
		Audited	Unaudited	Audited	Audited	Audited	
1	Total income from operations	0.24	0.18	0.16	0.78	0.68	
2	Net Profit/(Loss) for the period (before tax, exceptional and/or extraordinary items)	(42.13)	(52.18)	(24.61)	(188.86)	50.12	
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional and/or extraordinary items)	(42.13)	(52.18)	(24.61)	188.86)	50.12	
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional and/or extraordinary items)	(62.89)	(47.02)	106.41	(194.51)	195.08	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(62.89)	(47.02)	(558.69)	(194.51)	(470.02)	
6	Equity Share Capital	90.00	90.00	90.00	90.00	90.00	
7	Earnings Per Share (of Rs.10/- each) (for continuing and discontinued operations) Basic:	(6.99)	(5.22)	11.82	(21.61)	21.68	

tes:
The above is an extract of the detailed format of Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligat Requirements) Regulations, 2015.

The Statutory Auditors have carried out the audit of the accounts for the quarter and twelve months ended 31 March 2021 and
The full format of the quarterly financial results are available on the websites of Stock Exchange at www.bseindia.u

For India Radiators Limited

E N Rangaswam Whole-time Director Place: Chennai Date: 31 May, 2021 DIN: 06463753

ગણેશ હાઉસીગ કોર્પોરેશન લિમિટેડ

4 2 -9	ı					(રૂપિયા લા
કમ તાં.	વિગતો	ત્રણ માસના અંતે	પૂર્વવતી ત્રણ માસ અંતે	અગાઉના વર્ષે સમાપ્ત થયેલ અનુરૂપ ત્રણ માસ	नाशांडीय वर्षना अंते	पूर्ववती नाशांडीय वर्षना अंते
		૩૧/૦૩/૨૦૨૧ (ઓડિટેડ)	૩૧/૧૨/૨૦૨૦ (અનઓડિટેડ)	3૧/૦૩/૨૦૨૦ (ઓડિટેડ)	૩૧/૦૩/૨૦૨૧ (ઓડિટેડ)	૩૧/૦૩/૨૦૨૦ (ઓડિટેડ)
q	કામકાજમાંથી ફુલ આવક (ચોપ્ખી)	FC 9E 3F	£999.23	3480.94	92.693.69	PP. EEees
á	સમયગાળા માટે ચોખ્ખો નફો/ (નુકશાન) (કર અને / અથવા અપવાદ રૂપ ચીજો પહેલા)	99.822	(38.948.)	(ep. 5635)	(90, P\$8PP)	(EP. 3ESEP)
3	સમયગાળા માટે કર પહેલાનો ચોપ્ખો નફો/(નુકશાન) (અપવાદરૂપ ચીંજો પછી)	53.822	(38.948)	(ep.5635)	(90,95899)	(EP, 3E9EP)
ŏ	સમયગાળા માટે કર પછીનો રોખ્ખો નફો/(નુકશાન) (અપવાદરૂપ ચીજો, જોડાયેલનો નફામાં ભાગ અને બિનનિયંત્રિત હિત સિવાય)	(45.68)	(3402.54)	(348325)	(99,49409)	(૧૧૯૬૨.૬૫)
ч	સમયગાળા માટે કુલ વ્યાપક આવક (વ્યાપક નફો/નુકશાન (કર બાદ) અને અન્થ વ્યાપક આવક (કર બાદ))	(૫૨.૯૬)	(340८.६५)	(38.8898)	(90454.56)	(૧૧૯૬૨.૬૫)
ξ	ભરપાઈ થયેલી ઈક્વીટી શેર મૂડી	Pe. 55-38	Pe. 5598	PC. 55-98	86-55-99	Pe. 55-38
9	અન્ય ઈક્વીટી(મૂલ્યાંકન અનામત સિવાય) અગાઉના વર્ષના ઓડિટેડ પાકા સરવૈયામાં દર્શાવ્યા મુજબ				инеезия	34.998eh
۷	શેર દીઠ કમાછી (અપવાદ રૂપ ચીજો પહેલા)(દરેક રૂપિયા ૧૦ ની) (વાર્પિક નહી)(ચાલુ રાખવા અને બંદા થતી કામગીરી માટે)					
	q. 1 101	(PP.0)	(9.93)	(ξ.3€)	(28.89)	(08.89)
	ર. ઘટાડેલી	(PP.0)	(9.93)	(€.3∈)	(58.99)	(98.39)
	શેર દીઠ કમાછી (અપવાદ રૂપ ચીજો પછી) (દરેક રૂપિયા ૧૦ ની) (વાર્ષિક નહી)(ચાલુ રાખવા અને બંદા શતી કામગીરી માટે)					
	٩. મૂળ	(PP.O)	(9.93)	(ξ.3G)	(56.99)	(98.89)
	૨. ઘટાડેલી	(0,99,0)	(9.93)	(€,3€)	(29.36)	(08.89)